

સુસજ્જ હોસ્પિટલો, બહેતર સેવા

ઓન્ટેરિઓ રાજ્ય:

- અગામી 10 વર્ષો દરમ્યાન હોસ્પિટલોના બાંધકામ અને જીર્ણોદ્ધાર પાછળ આશરે 19 બિલિયન ડોલરનું મૂડીરોકાણ ફાળવી રહ્યું છે, જેમાં SickKids માટેના નવા પેશન્ટ કેર સેન્ટરની ડિઝાઇન અને નિર્માણના 2.4 બિલિયન ડોલરનો, અને ઓટાવા હોસ્પિટલના સિવિક કેમ્પસના પુનર્વિકાસ માટે ડિઝાઇન અને બાંધકામના 1.8 અબજ ડોલરનો સમાવેશ થાય છે.

OHIP+ થકી ફાર્માકેરનું વિસ્તરણ

ઓન્ટેરિઓ રાજ્ય:

- કોઈ વરિષ્ઠ નાગરિકને ક્યારેય જરૂરી દવાઓ વગર રહેવું ન પડે તે સુનિશ્ચિત કરવા 65 વર્ષ અને તેનાથી વધુ ઉંમરનાઓ માટે પ્રિસ્ક્રિપ્શન દવાઓ OHIP+ દ્વારા તદ્દન મફત કરી રહ્યું છે. ઓન્ટેરિઓ ડ્રગ બેનિફિટની વાર્ષિક કપાતો અને સહ-ચુકવણી નિર્મૂળ કરવાથી, તે ઓન્ટેરિઓના દરેક વરિષ્ઠ દીઠ દર વર્ષે સરેરાશ 240 ડોલરની બચત કરે છે.
- OHIP+ દ્વારા બાળકો અને યુવાનોને મફત પ્રિસ્ક્રિપ્શન દવાઓ પૂરી પડવાનું ચાલુ રાખે છે. 1 લી જાન્યુઆરી, 2018 ના રોજથી શરૂ કર્યા પછી, લગભગ ત્રણ મિલિયન પ્રિસ્ક્રિપ્શન દવાઓ કોઈપણ ખર્ચ વગર વહેંચવામાં આવી છે.
- OHIP+ વીમા દ્વારા આશરે બેમાંથી એક - લગભગ 6.4 મિલિયન લોકો - ની પ્રિસ્ક્રિપ્શન દવાઓનો ખર્ચ આવરી રહ્યું છે, અને કેનેડાના તમામ લોકો માટે પ્રિસ્ક્રિપ્શન દવાઓ નિશુલ્ક કરવાની યુનિવર્સલ ફાર્માકેર પ્રોગ્રામની ચળવળ - જે મેડિકેર વીમાનું વિસ્તરણ કરે છે - તેમાં સૌની આગેવાની કરી રહ્યું છે.

માનસિક સ્વાસ્થ્ય મહત્વનું છે

ઓન્ટેરિઓ રાજ્ય:

- વહેલુ રોગનિદાન કરવા અને રોગનિવારણની પ્રક્રિયા શરૂ કરવા આગામી બે વર્ષની અંદર ઓન્ટેરિઓની દરેક હાઇસ્કૂલમાં માનસિક સ્વાસ્થ્ય સહાય પ્રદાન કરી રહ્યું છે.
- સાર્વજનિક ભંડોળથી ચાલતી મનોરોગચિકિત્સા મેળવવાની સાનુકુળતા વધારી સમગ્ર રાજ્યના એન્ક્સાયટી (ચિંતા) અને ડીપ્રેશન (હતાશા) ની બીમારીવાળા બાળકો અને યુવાનો સહિત, 350,000 જેટલા વધુ લોકોને મદદ કરી રહ્યું છે.
- જેઓને સલામત, પોષાય તેવા તથા યોગ્ય આવાસોમાં રહી સંભાળસેવા લેવાની જરૂરિયાત છે તેમને માટે આગામી ચાર વર્ષમાં 2,475 વધુ સહાયક ગૃહ એકમો ઉમેરી રહ્યું છે.

- સેવાઓ મેળવવાની સાનુકુળતા સુધારવા, 12 થી 25 વર્ષની વયના યુવાનો માટે મહત્વપૂર્ણ સેવામાં રહેલી ત્રુટીઓ ભરવા, અને પુખ્તવયના માટેની સેવાઓ માટે જવાની વિધિમાં સુધારો કરવા ઓછામાં ઓછા 15 વધારાના યુવા સુખાકારી કેન્દ્રો (યુથ વેલનેસ હબ) તૈયાર કરી રહ્યું છે.
- અપૂરતી સેવા મેળવતા LGBTQ2S, જાતિભ્રમિત (રેસિઅલાઇઝ્ડ), ફેન્કોફોન, ન્યુ-કમર્સ (નવા આવેલા) અને ગ્રામ્ય યુવાનો માટે નવું લોકલ સર્વિસ પ્રાયોરીટી ફંડ પ્રસ્થાપિત કરી રહ્યું છે, જે માનસિક સ્વાસ્થ્ય સહાય સંગીન બનાવશે.

સેવા આપનારાઓ અને પરિવારોની મદદ કરવા

ઓન્ટેરિઓ રાજ્ય:

- નવો સિનિયર્સ હેલ્થી હોમ પ્રોગ્રામ દાખલ કરી રહ્યું છે. આ નવો કાર્યક્રમ વૃદ્ધો જ્યાં રહેવા માંગતા હોય ત્યાં, ઘરમાં રહેતા વરિષ્ઠો સાથે સંકળાયેલા ખર્ચાઓને માન્યતા આપે છે. તેમને સ્વતંત્ર રીતે રહેવામાં મદદ કરવા અને તેમના ઘરોને જાળવવાના ખર્ચને સરભર કરવા 75 કે તેથી વધુ વયના વરિષ્ઠોની અગ્રીમતા હેઠળના પાત્રતા ધરાવતા પરિવારો માટે આ કાર્યક્રમ દર વર્ષે 750 ડોલરનો લાભ આપે છે.
- આગામી ત્રણ વર્ષો દરમિયાન 650 મિલિયન ડોલરના મૂડીરોકાણથી હોમ એન્ડ કમ્યુનિટી હેલ્થ કેર અન્વયે સેવાઓની વધુ સાનુકુળતા પૂરી પાડી રહ્યું છે, જેમાં અંગત સહાયસેવા (પર્સનલ સર્વિસ) ના વધારાના 2.8 મિલિયન કલાકો અને વધારાની 284,000 નર્સિંગ મુલાકાતોનો પણ સમાવેશ થાય છે.
- સરેરાશ ચાર કલાક સુધી ખસેડી, લોગ-ટર્મ કેર હોમમાં દરેક વ્યક્તિ જે દૈનિક સેવા મેળવે છે તેનું પ્રમાણ વધારી રહ્યું છે.
- જે લોકો હવે વધારે લાંબો સમય સ્વતંત્રપણે રહી શકે તેમ ન હોય તેમને મદદ કરવા માટે આગામી 10 વર્ષો દરમિયાન-2022 સુધીમાં 5,000 નવી પથારીઓ ઉમેરીને-બીજી 30,000 નવી પથારીઓની સગવડ ઉભી કરી રહ્યું છે અને જેઓ તેમની સંભાળ રાખે છે તેમને મનની શાંતિ પ્રદાન કરી રહ્યું છે. આ નવી પથારીઓની સંખ્યા હાલની 30,000 પથારીઓ જે પુનઃવિકાસિત કરાઈ રહી છે તેમાં ઉમેરો કરે છે.